


Acknowledgements



નિવેદન

મારો “અખો અને તુકારામની કવિતા: સમીક્ષાત્મક અભ્યાસ” વિષય પેસ્નો આંગની દ્વિભાષી શોધ નિબંધ યુનિવર્સિટીને સૌંપત્તા આજે ઘણો આનંદ અનુભવું છું. મારી માતૃભાષા મરાઠી હોવા છતાં મારો જન્મ, ઘડતર, અભ્યાસ, કારકીર્દી બધું જ ગુજરાતીમાં, ગુજરાતમાં થયુ છે. શાળાનો અભ્યાસ મે વડોદરામાં જ ગુજરાતી માધ્યમમાં પૂરો કર્યો. પહેલેથી જ વાંચનનો શોખ અને ઝયિ હોવાથી આઈસમાં પ્રવેશ મેળવ્યો. સાહિત્ય તરફ મને નાનપણથી લગાવ રહ્યો છે. આરંભકાળથી જ ગુજરાતી સાહિત્યની વિદ્યાર્થી રહી હોવાને કારણે સાહિત્ય સાથે મારો ગાઢ સંબંધ રહ્યો છે. આમ, મરાઠી અને ગુજરાતી ભાષા સાહિત્ય સાથે બાલ્યકાળથી જ નિકટનો સંબંધ રહ્યો હોવાથી મને દ્વિભાષી અભ્યાસ કરવાનું સ્ફૂર્યું અને ગમ્યું.

અમારા કુટુંબમાં બધાંને જ સંગીત અને સાહિત્યનો ઉંડો રસ છે. અમે બાળપણા થી લગભગ દરરોજ તુકારામના અભંગો કેસેટ પ્લેયર ઉપર સાંભળતાં અથવા ટી.વી. પર જેતાં તુકારામનાં બજનો સતત સાંભળીને હું મોટી થઈ છું. તેથી મને મારાં રસરૂચિને સાનુક્ષુણ વાતાવરણ સાંપડ્યું છે.

M.A. પૂર્ણ કર્યા પછી આગળ ભણવાનો વિચાર તો હતો જ ! શું કરવું તેની દ્વિધા હતી. આખરે સુધાબેન પંડ્યાની મદ્દથી મને શેમાં રસ છે ? મને શું ગમે છે ? સાહિત્યમાં મને સૌથી વધુ શું આકર્ષે છે ? કયો સર્જક ? જેવા અનેક પ્રક્રો અંગે ચર્ચા-વિચારણાઓ કરતાં કરતાં બાલ્યકાળમાં પડેલા તુકારામના સંસ્કારો મારામાં જગત થયા. અખા વિશે અભ્યાસ કરવાનું નમ્ર સૂચન કર્યું. બહેને જણાવ્યું કે “અખા વિશે તો ઘણા અભ્યાસો થઈ ચૂક્યા છે તમે નવું શું રબૂ કરશો ? ત્યારે વારંવારની ગોછિ અને સંવાદને અંતે તુકારામ અને અખો જે મારા માનસપટ પર સતત છવાયેલા રહ્યા હતા એ બે મોટા ગજના સર્જકોને વિષય બનાવી અભ્યાસ કરવાનું નક્કી કર્યું. મને આ સર્જકોમાં રસ હતો પણ બંનેની ભાષા અલગ છે. જેકે મારી માતૃભાષા મરાઠી હોવા છતાંથી મને ગુજરાતી સમજવામાં કોઈ મુશ્કેલી પડી નથી. તેથી આ બંને સર્જકોનો થોડોક વધુ ઊંડાળબર્યો અભ્યાસ હું કરું તો એમાં મને ઔચિત્ય લાગ્યું. આવા સર્જકોને તપાસવા, સમજવાનું મને ગમશે એવું લાગવાથી આ અભ્યાસકાળ મારા માટે રસપ્રદ થઈ પડ્યો. અખો અને તુકારામ એક જ સમયગાળાનાં સરખા ઉદ્દેશો ધરાવતા અને બે જુદી ભાષાઓની સાહિત્યમાં માતૃભર પ્રદાન કરનારા સર્જકોમાં મોખરાનું સ્થાન ધરાવનારા હતા. તેથી મારો અભ્યાસ આગળ થયેલા અભ્યાસો કરતાં જુદો થશે એમ હું ચોક્કસ માનતી હતી. બંને ભાષા

સાહિત્યનો મને ઠીકઠીક અભ્યાસ હોવાથી મેં બનેનાં કાર્યોને સૂક્ષ્મતાથી તપાસવાનો અભિગમ રાખી શોધનિબંધ માટે આ વિષય પસંદ કર્યો છે. આ દ્વિભાષી અભ્યાસ હોવાથી અખાની કૃતિઓમાંથી જ્યાં ગુજરાતી દણાંતો આપ્યાં છે ત્યાં મરાઠી ભાવાર્થ આપ્યો છે, અને જ્યાં તુકારામના અભંગોનાં મરાઠી દણાંતો લીધા છે ત્યાં ભાવાર્થ ગુજરાતીમાં આપ્યો છે.

સમકાળીન સર્જકો દ્વારા બે નોખા સમજને અને બે નોખી ભાષાઓને કેવું સત્ત્વશરીલ સાહિત્ય પ્રાપ્ત થયું એ મારી શોધનો, મારા અભ્યાસનો વિષય બન્યો. અહીં મે માત્ર તુલનાનો અભિગમ રાખ્યો નથી, કારણકે બંને સર્જકો પોતાપોતાની રીતે પોતાના ક્ષેત્રમાં ઉંચાઈએ પહોંચેલા સર્જકો છે. એમના સાહિત્યનો તલસ્પર્શી સમીક્ષાત્મક અભ્યાસ કરવો એવો મારો અભિગમ રહ્યો છે.

Ph.D નું રજીસ્ટ્રેશન કરાવતી વખતે મારાં માર્ગદર્શક એવાં સુધાબહેને મને થોડો કાઢ્યો આવનારા સમયનો થોડો ઘણા ઘણા આપ્યો હતો. રજીસ્ટ્રેશન પછી લગ્ન અને ઘરની, પરિવારની, બાળકની જવાબદારી વિશે સભાન કરી હતી, પરંતુ મને આત્મવિશ્વાસ હતો કે હું આ અવરોધો ઓળંગવામાં સફળ રહીશ. હું જાણતી હતીકે Where there is a will, there is a way. હવે સમજય છે કે આ કથન ઈરછા શક્તિ પર કેટલો મોટો આધાર રાખવા ગેરે છે ! તુકારામનાં અભંગો સિવાય મરાઠી સાહિત્યનો શરૂઆતમાં મને ખાસ પરિચય નહોતો તેથી મરાઠીમાં તુકારામને વાંચી-સમજવાનો આયાસ આરંભ્યો. મને અખોકે તુકારામમાં જ નહીં પણ મરાઠી અને ગુજરાતી બંને ભાષાના વિશાળ, અગાધ એવા સાહિત્ય દરિયામાં આવી ગઈ છું એવો અનુભવ થયો. માર્ગ માર્ગદર્શક સુધાબહેને હિંમત, પ્રોત્સાહન અને હુંક આપી છે, કયારેક ઠપકો પણ આપ્યો છે. જેના પરિણામે આજે હું આ મારો શોધનિબંધ રંગું કરી શકું છું.

આ મહાશોધનિબંધ દરમ્યાન તુકારામના સાહિત્યને સમજવા અને મૂલવવા માટે મને મરાઠી વિભાગનાં ડૉ. સુષ્માબહેન કારોગલ, અને મૃણાલિની બહેન કામતનો સાથ અને સહકાર સહજભાવે પ્રાપ્ત થયાં છે જે માટે હું એમની ઋણી છું. શરૂઆતમાં તો બીજાં બધાંની જેમ હું પણ એવું માનતી હતી કે થીસીસ લખવાનું કામ સહેલું છે પરંતુ જેમજેમ સર્જકની કૃતિઓ અને તત્ત્વજ્ઞાનને સમજવામાં ઊંડી ઉત્તરતી ગઈ તેમતેમ સમજયું કેટલા વીસે સો થાય ! ભણતાં ભણતાં જાણો કે થાક લાગવા માંડ્યો. સાચે જ એક ગૃહિણી અને માતા માટે અભ્યાસ અવિરત પણે ચાલુ રાખીને પીએચ.ડી. જેવી ઉચ્ચ ડીગી પ્રાપ્ત કરવાનું કાર્ય આટલું બધું કઠણ કેમ લાગ્યું હશે તે હવે આજે સમજયું.

મારા માતા, પિતા, પતિ અને દીકરીએ આ સમયગાળા દરમ્યાન મને જે રીતે સાચવી છે તે લાગણી વ્યક્ત કરવા શરૂ ઓછા પડશે. મારી માર્ગદર્શક સુધાબહેન અને મારા સ્વજનો જ મારી શક્તિ બની રહ્યો છે. તુકારામના મરાઠી પુસ્તકોનો અનુવાદ કરી સમજવામાં તેમજ વિવિધ પુસ્તકો અને ગાથાઓના અર્થઘટનો કરવામાં તકલીફીની સાથેસાથે મને ધણો આનંદ પણ મળ્યો છે. મરાઠી વિભાગની મિત્ર એવી દીપ્તિ કુલકણીનો પુસ્તકો સ્થૂચવવા બદલ આભાર માનું છું. પૂર્વવાંચનમાં મારા મિત્રો કાંતિ માલસતર અને જ્યંતભાઈ ઉમરેઢિયાએ મને ધણી લાગણીસભર સહાય કરી, પોતાનો અમૂલ્ય સમય ફાળયો તે માટે તેમનો આભાર માનું છું. મરાઠી પૂર્વ રીડિંગ માટે મદદ કરનાર સૌ જ્યશ્રીબેન જેખીના મળેલા પ્રેમાળ સહયોગને આ ક્ષણે સ્મર્નું છું. સંદર્ભગ્રંથોની સ્ત્રી બનાવવા માટે મદદ કરનાર મિત્ર પત્રા ત્રિવેદીને પણ આ ક્ષણે યાદ કર્યા વિના ન ચાલે.

મારે આભાર તો સહદ્યી સૌનો માનવાનો રહ્યો જેમણે મારી આ અભ્યાસયાત્રામાં અનેકવિધ રીતે રસ દાખવ્યો. હાથ ધરેલું આ કપરું કાર્ય પરિપૂર્ણતાએ પહોંચ્યું છે તેનું સુખદ પરિણામ તે આ મહાશોધનિબંધ ! મહાનિબંધના પ્રિન્ટિંગ માટે શ્રી પિંકલભાઈ પુરોહિતે રાત-દિવસ જેયા વિના મને મદદ કરી છે, જેમના સબળ પુરુષાર્થ વિના આ કાર્ય સમયસર પૂર્ણ કરવાનું કઠિન હતું.

પ્રત્યક્ષ અને પરોક્ષરીતે નાનીમોટી સહાય કરનાર સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું.

રજૂ કરનાર

Chaitali Salunkhe
ચૈતી ભગવંત સાણુકે (૧૬-૬-૦૭)